

## આંખની સંભાળ

માનવ શરીરએ ઈશ્વરની અમૂલ્ય દેન છે. જેમાં જુદા-જુદા અવયવો અને ઈન્દ્રીયો આવેલાં છે. આંખો આપણા શરીરનું બહુ જ મહત્વનું અંગ છે અને દ્રષ્ટિ કુદરતથી મળેલ અદભુત ભેટ છે. શરીરની જ્ઞાનેન્દ્રીયોમાં સૌથી અગત્યની ઈન્દ્રીય આંખ છે. આંખો અમૂલ્ય છે દ્રષ્ટિ વગાર જીવન લાયાર અને પરાવલંબી થઈ જાય છે. આ મહત્વની બાબત આપણો જાણતા હોવા છતાં પણ ધણી વખત આંખોની જાળવણી માટે આપણો પૂરતી દરકાર લેતા નથી. તેથી જ આંખોની જાળવણીને આપણી દિન ચર્ચાનો એક ભાગ બનાવવાની ટેવ પાડવી જરૂરી છે.

તો આવો આપણો આંખોની તકલીફો અને જાળવણી અંગે જાણીએ

## આંખોની સામાન્ય તકલીફો

- આંખ લાલ થવી.
- આંખમાં ખીલ થવા.
- આંજણી થવી.
- કુલુ પડવું.
- કંકરી કે કચરો પડવો.
- મોતિયો
- નેગપટલની ખરાબી
- જામર
- ચશ્માના નંબર વધવા.



- અપૂરતી ઊધ અને આરામથી કે ક્યારેક પોષણ યુક્ત ખોરાકના અભાવને કારણે આંખોની નીચે કુંડળા થવા.
- આંખો ઊડી ઉત્તરી જવી.
- આંખો થાકેલી લાગવી.
- આંખો સુજોલી(પફી) લાગવી.
- આંખો આવવી (કંજેક્ટીવાઈટીઝ)

આંખોની આવી સામાન્ય તકલીફોથી બચવા આંખોનો યોગ્ય ઉપયોગ જાણી લઈએ.

- આંખોને જોર કરીને કે ખોચીને જોવી નહી જોવા માટે શ્રમ કરવો નહી.
- આંખોને ઢીલી/સામાન્ય રાખવી.
- આંખોના પલકારા કુદરતી રીતે થવા દેવા.
- પાંપણ વારંવાર પટપટાવવી નહી.
- વાંચતી વખતે પુસ્તક ૧૨થી ૧૪ ઈચ્છ દૂર રાખવું.
- ચાલુ વાહને વાંચન ટાળવું.
- અતિશય જળહળતા અથવા અતિજાંખાં પ્રકાશમાં વાંચવું નહી.
- સિનેમા અને ટીવી જોવા માટે આંખો ખોચવી નહી. પડદો ઓછામાં ઓછો ૧૦ ફૂટ દૂર રહેવું જોઈએ.
- ટીવી જોતી વખતે લાઈટ ચાલુ રાખવી. અંધારામાં ટીવી જોવું નહી.

## આંખો સારી રહે તે માટેના ઉપાયો / ટેવો

- પાણીની છાલકો - દિવસમાં ત્રણથી ચાર વાર ઠંડા પાણીની દસ-બાર છાલકો મારવી.
- હથેળી વડે આંખો ટાંકવી - થાકેલી આંખોને આનાથી સારો આરામ મળે છે.
- કુમળા સૂર્યના કિરણો ખુલ્લી આંખે જીલવા.
- આંખોને દિવસમાં બે-ત્રણ વાર ત્રિફળાના પાણીથી ધોવી અથવા ચુંબકીય પાણીથી ધોવી અને કઈક ન હોય તો ઠંડા પાણીથી ધોવી.
- મીઠાવણા પાણીની વરાળ લેવી જે મોઢાં ઉપર આવે તો પણ વાંધો નથી.
- રાત્રે ઠંડા પાણીથી પગ ધોવાથી સારી ઊંઘ આવે છે અને તેની આંખો સ્વસ્થ રહે છે.

## આંખોની કસરતો

- આંખ દાબ - આંખોને હાથ અડાડયા વગર બંને આંખો પર ચારે બાજુથી દબાશ લાવો. આંખોને મજબૂત રીતે દબાવી મનમાં ત્રણ ગણો પછી ધીરે ધીરે મૂળ સ્થિતિમાં આવો.
- જુદી જુદી દિશામાં આંખોને ફેરવવી - ડાબેથી જમણો , જમણેથી ડાબે, ઊપર નીચે, કોસમાં આંખોને ફેરવવી -કુલ વીસ વખત આ કસરત કરવી.
- આંખોને અર્ધગોળ અને પૂર્ણ ગોળાકારમાં ફેરવવી (કુલ બાર વખત).

## આંખોની જળવણી

પ્રમાણસર પોષક ખોરાક લેવાથી સંપૂર્ણ શરીરનું આરોગ્ય તો જળવાય છે. અને આંખો પણ સ્વસ્થ રહે છે. આંખો માટે નીચે જણાવેલાં પ્રજીવકો (વિટામીનો) ખાસ જરૂરી છે.

- પ્રજીવક એ (વિટામીન એ) - તે પાંદડા વાળી ભાજાઓમાંથી પુષ્કળ પ્રમાણમાં મળે છે. તો રોજંદા ખોરાકમાં પાંદડાવાળી ભાજાનો ઉપયોગ ખુબ કરવો તે ઉપરાંત ગાજર, પપૈયું, ટમેટોં, સરગવાનાં ફુલ અને સીગો, ચીજ, દૂધ, સંતરા, અણસી વિગેરેમાંથી મળે છે.
- પ્રજીવક ડી (વિટામીન ડી) - સવારના કુમળાં તડકામાંથી કુદરતી રીતે આપણાને આ પ્રજીવક મળી રહે છે. જેની ખામીથી આંખમાં મોતિયો થવાની સંભાવના રહે છે.
- પ્રજીવક સી (વિટામીન સી) - જે ધાવની રૂઝમાં પણ ધ્યાં મદદરૂપ થાય છે. આની ઉણપથી આંખો થાકવી, આંખો ભારે લાગવી વિગેરે તકલીફો થઈ શકે છે. આ પ્રજીવક ખાંટા-મીઠાં ફળોમાંથી પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે. આંમળાં-જામફળ તેના ખાસ સ્ત્રોત છે.
- પ્રજીવક બી (વિટામીન બી) - સારી દ્રષ્ટિ માટે આ પ્રજીવક જરૂરી છે. જે મુખ્યત્વે કાકડી, કેળાં, દ્રાક્ષ, દૂધ, દહી, લીલાં શાકભાજમાંથી મળી રહે છે. કઠોળ, જેવાં કે મગ, મઠને ફણગાવીને પણ આ પ્રજીવક પ્રાપ્ત કરી શકાય છે.

ઉપર જણાંવ્યા મુજબ શરીરનાં અત્યંત જરૂરી એવા અંગ આંખની સંભાળ આપ આપની દિન ચર્યામાં થોડો સુધારો કરીને આંખને જાળવવાની કેટલીક ટેવો, કસરતો

**By Dr.Meena Shah**